

Prime Minister to address High-Level Segment of ECOSOC on 17 July, 2020

July 16, 2020

17 જુલાઈ, 2020 નાં રોજ વડાપ્રધાન ઈસીઓએસઓસીનાં ઉચ્ચ-સ્તરીય વિભાગને સંબોધિત કરવાનાં છે

જુલાઈ 16, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે 17 જુલાઈ 2020, શુક્રવારનાં દિવસે 9:30-11:30 વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ સત્રનાં આ વર્ષનાં ઉચ્ચ-સ્તરીય વિભાગમાં વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન કરશે. ભારતનાં વડાપ્રધાન નોર્વેનાં વડાપ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેરેસ સાથે વેલોડિક્ટરી સત્રમાં ઉદ્બોધન કરશે.

વાર્ષિક ઉચ્ચ-સ્તરીય વિભાગ સરકાર, ખાનગી ક્ષેત્ર, સિવિલ સોસાયટી અને શિક્ષણ ક્ષેત્રનાં ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓનાં વૈવિધ્યતા ધરાવતા જૂથને એકત્રિત કરે છે. આ વર્ષનાં ઉચ્ચ-સ્તરીય વિભાગનો વિષય “કોવિડ-19 બાદનાં બહુઆયામવાદ: 75 મી વર્ષગાંઠ પર આપણે ક્યાં પ્રકારનું સંયુક્ત રાષ્ટ્ર જોઈએ છે” છે.

પડકારજનક આંતરરાષ્ટ્રિય વાતાવરણ અને કોવિડ-19 મહામારી સામે ગોઠવેલ, આ સત્ર બહુઆયામવાદનાં ક્રમને આકાર આપતા અતિ મહત્વનાં બળો પર અને પ્રબળ નેતૃત્વ, અસરકારક આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ, વ્યાપક સહભાગીતા અને વૈશ્વિક જાહેર માલસામાનની સુધારેલી અગત્યતા મારફત વૈશ્વિક એજન્ડાને વેગ આપવાનાં માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ 17 જૂનનાં રોજ 2021-22 કાર્યકાળ માટે સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્ય તરીકે ભારતની ભારે બહુમતિથી ચૂંટણી થયા પછી વડાપ્રધાન માટે વ્યાપક સંયુક્ત રાષ્ટ્રનાં સભ્યોને સંબોધિત કરવાની પ્રથમ તક હશે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની 75 મી વર્ષગાંઠ પર રાખવામાં આવેલો ઈસીઓએસઓસીનાં ઉચ્ચ-સ્તરીય વિભાગનો વિષય ભારતની સુરક્ષા પરિષદની પ્રાથમિકતા સાથે પણ એકરૂપતામાં છે, જેમાં આપણે કોવિડ-19 પછીનાં સમયમાં ‘સુધારેલ બહુઆયામવાદ’ માટે આહવાન કર્યું છે. તે ઈલસીઓએસઓસીની આરંભની અધ્યક્ષતાનાં ધારક તરીકે પણ ભારતની ભૂમિકાને યાદ કરે છે (સર સામાસ્વામી મુદ્રાલિયર, 1946 માં). વડાપ્રધાને અગાઉ જાન્યુઆરી 2016 માં ઈસીઓએસઓસીની 70 મી વર્ષગાંઠ પર પણ વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન કર્યું હતું.

નવી દિલ્હી

જુલાઈ 15, 2020

DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.

